



MEHTA INTEGRATED FINANCE LIMITED

CIN - L65910GJ1985PLC007692

Date: 02/06/2023

To,
BSE Limited
Corporate Relationship Department
PJ Towers,
Dalal Street,
Mumbai - 400 001

Sub.:- Audited Financial Results -31.03.2023- Publication of Advertisement in News Papers

Scrip Code: 511377


Dear Sir/Madam,

We submit herewith copies of the published advertisements in Newspapers namely ; Free Press –English Edition and Lok Mitra in Gujarat Edition in respect of Audited Financial Results of the Company for the 4th quarter and financial year ended on 31st March, 2023 duly approved by the Board on 30.05.2023 for information and Record.

Kindly take the same on record.

Thanking You,

Yours faithfully,
For, Mehta Integrated Finance Limited



Kamleshbhai P. Patel
Company Secretary

Enclosure: A/a

ISO Member Countries resolve to boost consumer engagement, renew focus on sustainability in Standardisation

The four-day 44th ISO COPOLCO Plenary hosted by the Bureau of Indian Standards (BIS) from 23-26 May, 2023 concluded at New Delhi on 26.05.2023 with the keynote address from Ms. Nidhi Khare, Additional Secretary, Ministry of Consumer Affairs, Food & Public Distribution in the presence of Ms. Mamta Upadhyay Lal, Additional Director General, BIS, Prof. B. Metri, Director, Indian Institute of Management, Nagpur and Chairman, Management & Systems Division Council, BIS and Ms. Sadie Dainton, Chairperson, COPOLCO and other senior officials and representatives of ISO and member countries. Senior officials, scientists and staff of BIS also marked their presence during the event. During her keynote address, Ms. Nidhi Khare mentioned, "We have made significant improvement in the area of consumer protection during the recent years. Also, robust consumer grievance redressal systems have been developed to help fast-tracking resolution of such matters." While stressing the need to keep sustainability as a core consideration in standardisation, she said, "Manufacturers should ensure that products are designed for sustainability parameters, they can also be partners in the process of reducing e-waste." Ms. Mamta Upadhyay Lal highlighted the activities and initiatives of BIS. She mentioned, "BIS has taken up a wide range of initiatives, such as Manak Manthan, Quality Connect etc. which are aimed at enhancing consumer engagement in standardisation." Ms. Sadie Dainton expressed her appreciation for all member countries for their ongoing engagement in standardisation. She highlighted the commitment to raising consumer stakeholders' awareness of the value of standards for consumer protection and for engaging and involving consumers to develop credible and robust standards which address real problems faced by real people, by setting out good practice for organizations to minimize the risk of harm to consumers. ISO Officials attending the Plenary stated that the 44th COPOLCO Plenary has successfully achieved its objectives of empowering consumers for a sustainable future, through in-depth discussions and exchange of national and international experiences of the challenges that consumers face in making sustainable choices and promoting the development of the circular economy. The officials also informed that ISO has renewed its commitment to incorporate the objectives of the United Nations Sustainable Development Goals into its standards programme and giving a voice to vulnerable stakeholders most affected by climate change in its standards and policy work. ISO Secretariat also shared, "On behalf of ISO we express our deep gratitude to the Bureau of Indian Standards and the Indian government for their hospitality and support in hosting the 44th meeting of ISO/COPOLCO and upholding the importance of the consumer as a critical partner in society and the economy. We were very happy to interact with representatives of over 40 members and liaison organizations from around the world and with Indian consumer organizations, attending in person and online." Notably, the plenary of the International Organisation

DRDO holds interaction with the industry in Hyderabad to understand their concerns & raise awareness about its policies

A day-long industry interaction and brainstorming session was organised by Defence Research and Development Organisation (DRDO) at Research Centre Imarat (RCI), Hyderabad on May 27, 2023. It was aimed at bringing all defence industries, including MSMEs & start-ups, to one platform for understanding their concerns while increasing awareness on various industry-friendly initiatives and policies of DRDO. More than 180 industries participated in the event. Secretary Department of Defence R&D and Chairman DRDO Dr Samir V Kamat chaired the open brainstorming session "Chintan". He assured the industry that DRDO will extend all possible support to them and will play the role of a mentor in building their capabilities to make India a net defence exporter. The DRDO Chairman emphasized the need to undertake such initiatives on a regular basis as these events provide a renewed impetus to boost the Indian defence manufacturing sector to achieve complete self-reliance. Director, Directorate of Industry Interface & Technology Management (DIITM) Shri Arun Chaudhary gave a brief overview on various initiatives

and policies of DRDO which support the Indian industries. He explained the process of 'Transfer of Technology' by DRDO to the industry, bringing out the salient features of the Policy. He explained the necessity and process of selection of industries as Development Assessment partners. The highlights of Technology Development Fund (TDF) scheme were aptly explained to industry. He also gave details of DRDO policy and procedures on utilisation of its Infrastructure Testing facility and DRDO patents by Indian industry. The DRDO, in collaboration with Quality Council of India (QCI), has developed the 'System for Advanced Manufacturing Assessment and Ranking (SAMAR)' certification, a benchmark to measure the maturity of defence manufacturing enterprises, including MSMEs. During the event, an overview on SAMAR and IT-enabled online model for digitised assessment with geo-tagging and time-stamping were also presented. The DRDO is offering SAMAR to micro and small industries at subsidised cost. Industry partners from MSMEs & large enterprises as well as start-up entrepreneurs gave presentations on their experience of working with DRDO.

MEHTA INTEGRATED FINANCE LIMITED
 Regd. Office: 3, Law Garden Apart. Scheme-1, Opp. Law Garden Ellisbridge, Ahmedabad-380 006.
 Phone No.: +91 79 26561000, E-mail: mifl_in@yahoo.com, Website: www.mehtaintegratedfinance.com
 CIN: L65910G1985PLCO0792

Extract of Statement of Standalone Audited Financial Results for the 4th Quarter/Financial year ended 31 March, 2023

Sr. No.	Particulars	Quarter ended		Financial Year ended	
		31 March 2023	31 March 2022	31 March 2023	31 March 2022
1	Total Income	31.33	95.56	4.40	38.33
2	Total Expenses	14.90	42.51	50.39	69.22
3	Net profit / (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	16.42	53.05	-45.99	-30.89
4	Net profit / (loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	16.42	53.05	-45.99	-30.89
5	Net profit / (loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	16.42	53.05	-45.99	-30.89
6	Total comprehensive income for the period (for the period (after tax))	16.42	53.05	-45.99	-30.89
7	Paid up equity share capital	500.00	500.00	500.00	500.00
8	Reserve (excluding revaluation reserve)	0	933.16	0	875.51
9	Reserve per share (of Rs. 10/-each) Basic and Diluted	0.33	1.07	-0.92	-0.62

Note: (1) The above is an extract of the detailed format of Audited Financial Results for the 4th Quarter and Financial Year ended 31 March 2023 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.
 (2) The full format of the same along with the note is available on the website of stock exchange at www.bseindia.com and at the website of the Company at www.mehtaintegratedfinance.com

For Mehta Integrated Finance Limited
 Sd/-
 Ching D. Mehta
 Whole-time Director
 DIN: 00484709

PLACE: Ahmedabad
 Date: 30/05/2023

ICICI Home Finance
 Corporate Office: ICICI Home Finance Company Limited, ICICI HFC Tower, Andheri - Kuria Road, Andheri (East), Mumbai - 400059, India
 Branch Office: 4th Floor, 410, Milestone Vibrant, Opp. Apple Hospital, Udhna Darwaja, Surat- 395002

Notice for sale of immovable assets
 Notice for sale of immovable assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (b) of the Security Interest (Enforcement) Rules, 2002

The notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the Physical Possession of which has been taken by the Authorized Officer of ICICI Home Finance Company Ltd., will be sold on "As is where is", "As is what is", and "Whatever there is", as per the brief particulars given hereunder:

Sr. No.	Name of Borrower(s) / Guarantor(s) / Legal Heirs. Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price / Earnest Money	Date and Time of Property Inspection	Date & Time of Auction
(A)	1. Mukeshkumar Namdeo Jadhav (Borrower) Aruna Mukeshkumar Jadhav (Co-Borrower) Loan Account No. LHSUR0001329249	Flat No. E-108 1St Flr, Ushav Residency, 189/5, Nr. Dindoli Lake, B/H Rami Park Society, Dindoli Surat- 394210.	Rs. 21,13,968/-	Rs. 15,93,302/-	June 12, 2023 11:00 AM	June 20, 2023 02:00 PM
	2. Chetanbhai Dharmesh Patel (Borrower) Patel Dharmesh Dineshchandra (Co-Borrower) Loan Account No. LHSUR0001293715	Shop No. 6 1st Flr Piramdy Icon Survey No. 103 Palspur, Jakhoda Road, Jahangirabad Surat Gujarat-395005	Rs. 39,75,843/-	Rs. 100/-	June 12, 2023 11:00 AM	June 20, 2023 02:00 PM

The online auction will be conducted on the website (URL: <https://BidsAuctionDeal.com>) of our auction agency GlobeTech. The Mortgagee/notice are given a last chance to pay the total dues with further interest till June 19, 2023 before 05:00 PM else these secured assets will be sold as per above schedule. The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/Demand Draft (DD) (Refer Column E) at ICICI Home Finance Company Limited, 4th Floor, 410, Milestone Vibrant, Opp. Apple Hospital, Udhna Darwaja, Surat-395002 on or before June 19, 2023 before 04:00 PM. The Prospective Bidder(s) must also submit signed copy of Registration Form & Bid Terms and Conditions form at ICICI Home Finance Company Limited, 4th floor, 410, Milestone Vibrant, Opp. Apple Hospital, Udhna Darwaja, Surat-395002 on or before June 19, 2023 before 05:00 PM. Earnest Money Deposit Demand Draft (DD) should be from a Nationalized/Scheduled Bank in favor of "ICICI Home Finance Company Ltd. - Auction" payable at Surat.

For any further clarifications with regards to inspection, terms and conditions of the auction or submission of tenders, kindly contact ICICI Home Finance Company Limited on 7021072899 or our Sales & Marketing Partner Nexsol Solutions Private Limited. The Authorized Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons. For detailed terms and conditions of the sale, please visit <https://www.icicifin.com>

Authorized Officer
 ICICI Home Finance Company Limited
 Place: Surat

Arman Holdings Limited
 Registered Office : 419, Rajhans Heights, Mini Bazar, Varachha Road, Surat 395006.
 Tel : 9586006569. Email ID : armanholdingspl@gmail.com Website : www.armanholdings.in
 CIN : L78620G19922PL082961

Extracts of Audited Standalone Financial Results for the Quarter and Financial year ended 31/03/2023 (Amt. Rs. In Lakhs)

Particulars	Quarter ended		For the year ended	
	31/03/2023	31/03/2022	31/03/2023	31/03/2022
Total income from Operations (net)	104.06	71.37	406.88	406.88
Net Profit from ordinary activities after tax	0.87	0.07	2.09	2.44
Net Profit for the period (after extraordinary items and Comprehensive Loss)	0.05	0.07	2.09	2.44
Paid up equity share capital (Face Value of Rs.10/- each)	521.05	521.05	521.05	521.05
Reserve excluding Revaluation Reserves as per balance sheet #			71.64	139.66

Earnings Per Share before extraordinary items (of Rs.10/- each) (not annualized):
 (a) Basic 0.030 0.017 0.053 0.063
 (b) Diluted 0.030 0.017 0.053 0.063

Earnings Per Share after extraordinary items (of Rs.10/- each) (not annualized):
 (a) Basic 0.030 0.017 0.053 0.063
 (b) Diluted 0.030 0.017 0.053 0.063

Note: (1) The above is an extract of the detailed format of quarterly/annual audited financial results filed with the stock exchange under Regulation 33 SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarterly/annual audited financial results are available on the Stock Exchange's website i.e., www.bseindia.com and also on the website of the company at www.armanholdings.in

For Arman Holdings Limited
 Sd/-
 Deepak Kumar Rabel
 Managing Director
 DIN : 05201110

Date : 30/05/2023
 Place : SURAT

PUBLIC NOTICE

ICICI Bank Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WFI IT Park, Wagale Industrial Estate, Thane, Maharashtra-400604

The following borrower/s have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the above bank and are hereby notified to pay the amount due within the period of 60 days from the date of publication of this notice under Section 13 (2) of Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresses, however it was not served and hence they are hereby notified by way of this public notice.

Sr. No.	Name of the Borrower/ Co-Borrower/ Guarantor/ Loan Account Number & Address	Property Address of Secured Asset/ Asset Encumbered	Date of Notice Sent/ Out-Date of Notice	NPA Date
1	Arvind Manoharsingh Dhami/ (LBVP00005992428/ LBVP0000601057) & Nagar, Kunal Aswari, Opp Civil Hospital, Basia Faliya, Dadra And Nagar Haveli, Silvassa- 396230	Flat No. 602, 6th Floor, Building B, Rajshree Heights, Kamoli Faliya, Silvassavurvy No. 112/21/12, Survey No. 95/1, Vapi 396191	April 21, 2023	10-11-2022
2	Bhawani Singh/ Manita Kanwar/ (Wing 2 Violet B, Spring City Phase 1B, Near Masat Police Station, Meghwa Road, Masat, Silvassa- 396230)	Flat No. VB803, 6th Floor, Building F (Wing 2 Violet B, Spring City Phase 1B, Near Masat Police Station, Meghwa Road, Masat, Silvassa, Dadra And Nagar Haveli, Survey No. 185/1, 186/1/1, 186/3, 187/1, 187/2, 188, 189, Vapi 396191)	April 21, 2023	05-12-2022

The steps are being taken for substituted service of notice. The above borrower/s and/or their guarantors (as applicable) are advised to make the payments of outstanding within the period of 60 days from the date of publication of this notice else further steps will be taken as per the provisions of Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Date : May 31, 2023
 Authorized Officer
 ICICI Bank Limited

SHUBHAM POLYSPIN LIMITED
 (CIN: L17120J2012PLCO69319)

Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jetpura- Basantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
 E-Mail ID: ankit@shubhamgp.com Website: www.shubhampolyspin.com

AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023

Particulars	Quarter ended on		Year ended on	
	31-03-2023 (Audited)	31-03-2022 (Audited)	Year ended on 31-03-2023 (Audited)	Year ended on 31-03-2022 (Audited)
Total Income from operations	1105.30	1324.79	4692.71	5504.67
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items #)	17.15	10.66	114.58	124.99
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items #)	17.15	10.66	114.58	124.99
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items #)	10.43	(15.69)	83.39	67.53
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	10.43	(15.69)	83.39	67.53
Equity Share Capital	1212.20	1102.00	1212.20	1102.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year) (for continuing and discontinued operations)	0.09	(0.14)	0.69	0.61

Note: (a) Basic & (b) Diluted

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements), 2015. The full format of the Quarterly and Yearly Financial Results is available on the Stock Exchange website (www.bseindia.com) and on the website of the Company (www.shubhampolyspin.com).
 3 - # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Date: 30th May, 2023
 Place: Borisana

FOR, SHUBHAM POLYSPIN LIMITED
 Sd/-
 ANKIT ANIL SOMANI
 MANAGING DIRECTOR (DIN: 05211800)

Unison Metals Limited
 CIN No: L5210G1990PLCO13964
 Reg. Office: Plot No.5015, Ph-IV, Nr. Ramol Cross Road, GIDC, Vavia, Ahmedabad-382445
 Website - www.unisongroup.net, Email: unisonmetals@gmail.com - Telephone - +91-7925841512

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2023

Particulars	Standalone		Year ended		Consolidated		Year ended	
	31st March 2023	31st March 2022	31st March 2023	31st March 2022	31st March 2023	31st March 2022	31st March 2023	31st March 2022
Revenue	1,04,48,00,000	1,02,00,00,000	1,04,48,00,000	1,02,00,00,000	1,04,48,00,000	1,02,00,00,000	1,04,48,00,000	1,02,00,00,000
Expenses	98,00,00,000	95,00,00,000	98,00,00,000	95,00,00,000	98,00,00,000	95,00,00,000	98,00,00,000	95,00,00,000
Profit before tax	6,48,00,000	7,00,00,000	6,48,00,000	7,00,00,000	6,48,00,000	7,00,00,000	6,48,00,000	7,00,00,000
Income tax expense	(1,00,00,000)	(1,00,00,000)	(1,00,00,000)	(1,00,00,000)	(1,00,00,000)	(1,00,00,000)	(1,00,00,000)	(1,00,00,000)
Profit after tax	5,48,00,000	6,00,00,000	5,48,00,000	6,00,00,000	5,48,00,000	6,00,00,000	5,48,00,000	6,00,00,000

1. This statement has been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 Accounting Standards Rules, 2015 (as amended). The statutory auditors of the company have carried out audit for the year ended March 31, 2023.

2. These results have been recommended for adoption by the Audit Committee in its meeting held on May 30, 2023, and approved by the Board of Directors at its meeting held on May 30, 2023. The quarterly results have been reviewed whereas the yearly results have been audited by the Statutory Auditors of the company.

3. The Company publishes standalone financial results along with the consolidated financial results. In accordance with the Ind AS 108, Operating Segments, the Company has disclosed the segment information in the consolidated financial results and therefore separate disclosure on segment information is given in the standalone financial results for the quarter or for the year ended March 31, 2023.

4. The Group's investment in the Chandanpara Enterprise, an associate accounted for by the equity method, is carried at Rs. 21.75 lacs on the consolidated balance sheet as at March 31, 2023, and the Company's share of the Associate's net income of Rs. 4.23 lacs is included in the Company's income for the year then ended. The Associate has an investment in a foreign entity which is carried at Rs. 201.60 lacs as accounts as at March 31, 2023. This amount of Rs. 201.60 lacs in the books of the associate has not been valued at fair value as the associate has not received the accounts of the foreign entity as on the balance sheet date. This matter has been qualified by the Auditors in their report.

5. In line with Ind AS - 108 operating segment and basis of the review of operation being done by the senior management, the operation of the group fall under 3 segments: (a) Stainless Steel (b) Frt Jobwork (c) Sodium Silicate

6. Note on Inventory lying at third party and amount receivable therefrom: The Company has outstanding receivables from Naaptol amounting to Rs. 133.12 Lacs. In addition, inventory of Unisil, lying at their warehouse amounts to Rs. 105.85 Lacs. Naaptol has appointed arbitrator to resolve the dispute between the company and Naaptol. Against this the company has approached the Hon'ble High Court at Mumbai to restrict the appointment of arbitrator appointed by Naaptol and to seek appointment of independent arbitrator by the court. The management is confident that the entire amount is recoverable. However as a matter of prudence the company has decided to make a provision at 10 percent per annum beginning from F.Y. 2022-23 on the aggregate provision as on March 31, 2023 stand at 30 percent.

7. EPS is not annualized for the quarter ended March 31, 2023, December 31, 2022 and March 31, 2022.

For Unison Metals Limited
 Sd/-
 (MAHESH CHANGRAN)
 Whole Time Director

Date: 30th May, 2023

WESTERN RAILWAY BHAVNAGAR DIVISION
CONSTRUCTION OF 12m WIDE SOI
 Executive Engineer, Gali Shanti, Division Office, Bhavnagar Para-364003 No. 01, 6th Floor, O.P.O. Box, Bhavnagar-364003. Date: 26.05.2023. Tender Details are as under Sr. No. 1, ESTender No. 08-BVP-2023-09B. Bidding Start Date: 29.05.2023. Date of Bidding Start: 02.06.2023. Date of Closing: 23.06.2023. The NIT has been uploaded on Railway Website www.rw.nic.in

Use us on: [Facebook](https://www.facebook.com/WesternRailway) [Instagram](https://www.instagram.com/WesternRailway)

